



આજોલાની ખેત પદ્ધતિ



:: લેખક ::

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર
નવસારી કૃષિ યુનિવર્સિટી
દેવિયાપાડા - ઉદ્ડુકુ ૦૪૦, જિ. નર્મદા

અજોલાની ખેત પદ્ધતિ

અજોલા (*Anabaena azolla*) સામાન્ય રીતે બંધિયાર પાણીમાં ઉગતી એક જલીય વનસ્પતિ છે. તાજા અજોલમાં ૦.૨ થી ૦.૩ % અને સૂક્ષ્મ અજોલમાં ૪ થી ૫ % નાઈટ્રોજન તત્વ રહેલ હોવાથી તેનો વિવિધ પાકોમાં જૈવિત ખાતર તરીકે ઉપયોગ થાય છે. તેમાં પ્રોટીનનું પ્રમાણ સર્વિશેષ હોવાથી તે પશુ આહારમાં પણ વપરાય છે. આ વનસ્પતિનો ઉપયોગ બાયોગેલ અને કૃષિનિયંત્રણ માં પણ થાય છે.

અજોલા ઉગાજવા માટે તલાવડી બનાવવાની રીત

- સાનુકૂળ જમીનમાં ૧૦મી. x ૫ મી. x ૨ ફૂટ ઊંડો અથવા ૫ મી. x ૫મી. x ૨ ફૂટ ઊંડો ખાડો બનાવો.
- ૧૦૦ થી ૧૫૦ માઇકોન જડાઈના એલ.ડી.પી.ઇ. પ્લાસ્ટિકને ખાડામાં તથા તેની અંદરની ચારે બાજુ દીવાલ પર તથા પાળની ઉપરની બાજુએ વ્યવસ્થિત રીતે પાથરો.
- ઉપજાવ માટીને ખાડામાં પ્લાસ્ટિક ઉપર લગભગ ફૂટ સુધી પાથરી દો. તેના ઉપર સપ્રમાણમાં છાણની રબડીનો પાતળો થર બનાવી ખાડાને આશરે ૫ થી ૧૫ સે.મી. જેટલો ભરી દો.
- શરૂઆતમાં તલાવડીમાં ૮-૧૦ કિ.ગ્રા. તાજ જીવંત અજોલા નાખવા.
- દર ૧૫ દિવસે / ૧૦૦ ગ્રા. ચો.મી. પ્રમાણો તાજ છાણની રબડી બનાવીને તલાવડીમાં નાખવી.
- જો ઉનાળા દરમ્યાન ગરમી વધારે રહેતી હોય તો અજોલાની સારી વૃદ્ધિ માટે ૫૦ % પ્રકાશની તીવ્રતાવાળી ગ્રીન નેટ વાપરી શકાય છે.
- તલાવડીમાં અજોલા નાખ્યા બાદ ૪-૮ દિવસ પછી ૧૦૦ સુપરફોસ્ફેટ અને ૧૦૦ ગ્રામ કાર્બોફિયુરન (ફ્યુરાડન) નો છંટકાવ કરવો.



- તલાવડીમાં બે થી ત્રણ અઠવાડીયા સુધી આશરે ૧૦ સે.મી. પાણીનું સ્તર સતત જાળવી રાખવું જરૂરી છે.
- અનુકૂળ પરિસ્થિતિમાં P મી. x P મી. ની તલાવડીમાંથી દર ૪-૭ દિવસે આશરે ૧૦-૧૫ કિ.ગ્રા. અજોલાનું ઉત્પાદન થાય છે.

રોપણ ડાંગરમાં અજોલા વાપરવાની રીત

- રોપણ ડાંગરમાં પાણી ભરેલી ક્યારીમાં ફેરરોપણી પછી ૫૦૦-૧૦૦૦ કિ.ગ્રા. / હે. ના દરે તાજા લીલા અજોલા પુંખી દેવાના હોય છે.
- ખેતરમાં અજોલાની ઝડપી વૃદ્ધિ માટે ડાંગરની ફેરરોપણી બાદ તરત જ નાઈટ્રોજનયુક્ત ખાતરના પ્રથમ હપ્તો અને ફોસ્ફરસયુક્ત ખાતરનો અડધો જથ્થો આપી દેવાથી ડાંગર અને અજોલા બનેની વૃદ્ધિ સારી થાય છે અને ૨૦ થી ૨૫ દિવસમાં સમગ્ર ક્યારીમાં અજોલા છવાઈ જાય છે.
- અજોલાને ડાંગરમાં પ્રથમ નિંદામણ સમયે પગથી અથવા પેડી વીડર કે અન્ય રીતે જમીનમાં દબાવવાથી પ્રતિ હેક્ટર દીઠ ૩૦-૪૦ કિ.ગ્રા. નાઈટ્રોજન સેન્ટ્રિય રૂપમાં જમીનમાં ઉમેરે છે.
- અજોલાની સારી વૃદ્ધિ માટે બાકીનો ફોસ્ફેટીક ખાતરનો જથ્થો આપી દેવો અને વપરાતી પાક સંરક્ષણ દવાઓનો ઉપયોગ કરવાથી અજોલામાં પણ આપોઆપ જીવાત નિયંત્રણ થઈ જાય છે.
- વૃદ્ધિ પામેલા અજોલાને પગથી અથવા અન્ય રીતે જમીનમાં દબાવી દેવા.



અજોલાને વિવિધ ઉપયોગ

- અજોલા રોપણ ડાંગરની સાથે અથવા અન્ય પાકમાં લીલા પડવાશ તરીકે વાપરી શકાય છે. ડાંગરમાં તે લગભગ ૨૦-૨૫% નાઈટ્રોજન યુક્ત ખાતરની બચત કરે છે.

નિંદામણનું નિયંત્રણ

- જમીનમાં સેન્ટ્રિય પદાર્થ ઉમેરવાથી જમીનની ફળકુપતા સુધરે છે.
- ડાંગરનું ઉત્પાદન ૮-૧૦% વધે છે.
- પોટેશિયમની ઉણપવાળી જમીનમાં ડાંગરના પાકમાં પોટેશિયમની લભ્યતા વધારે છે.
- ડાંગરની સાથે અજોલા વાવવાથી મથ્છર તથા ચુસિયાનો ઉપદ્રવ ઘટે છે.
- ઘઉં, બટાટા, શાકભાજ વગેરે પાકોમાં સૂકા અજોલા મૌઘા અખાદ ખોળના પૂરક તરીકે વાપરી શકાય છે.

અજોલાના ખેતીમાં નડતી મુશ્કેલીઓ

- અજોલાની વૃધ્ઘિ દરમ્યાન સ્પાયગેરા, લેમના, આલ્ગી વગેરે ઉગી નીકળે છે.
- સ્નેઇલ, પાયરાલીસ જેવી જીવાતો અજોલાને નુકશાન કરે છે.
- જમીનમાં ફોસ્ફરસની ઉણપ હોય તો અજોલાની વૃધ્ઘિ અટકી જાય છે.
- અજોલાની વૃધ્ઘિ દરમ્યાન પાણીની સવિશેષ જરૂરિયાત રહેતી હોવાથી પાણીની અધ્યતવાળા વિસ્તારમાં મુશ્કેલી નદે છે.
- ડાંગરની ક્યારીમાં અજોલા વધુ વરસાદી તણાઈ જાય છે.
- ઉનાળામાં ગરમીનું પ્રમાણ વધતાં અજોલાની વૃધ્ઘિ અટકી ન જાય તે માટે તલાવડી ઉપર શેડનેટ ટાંકવી જરૂરી છે.

અજોલાને પશુઓમાં ખોરાક તરીકે ઉપયોગ

અજોલામાં રહેલા પોષક તત્વો

- અજોલા પોષક તત્વોની દ્રષ્ટિએ ખુબ જ સમૃધ્ઘ છે. એમાં સુક્ક ભારના આધાર પર એમાં પ્રોટીનનું પ્રમાણ લગભગ ૨૦-૩૦% જેટલી આવે છે.
- અજોલામાં ખુબ વધુ માત્રમાં પ્રોટીન, ઓછા રેશા તેમજ શરીરના બીજા જરૂરી તત્વો જેવા કે એમીનો એસીડ, વિટામીન એ, બી-૧ ૨, તથા બીટા-કેરોટિન તેમજ બનીજ પદાર્થ જેવા કેલ્શીયમ, ફાસ્ફરસ, પોટેશીયમ, ફેરસ, કોપર, જીંક પણ આવેલા હોય છે. આ બધા ગુણોને કારણે અજોલા સસ્તુ, સુપાચ્ય અને પશુ આહાપના ઢૂપમાં ખેડૂત ભાઈ બહેનોની વચ્ચે ખુબ જ લોકપ્રિય બન્યું છે.

અજોલા ખવડાવવાથી થતા લાભો

- અજોલાને ચારણી અથવા વાંસના ટોપલામાં પાણીના ઉપરથી લેવામાં આવે છે. ત્યાર પછી અજોલાને ચોખ્ખા પાણીથી ધોઈ દાણ સાથે મિશ્ર કરી ખવડાવવામાં આવે છે.

- અજોલા સસ્તુ તેમજ પૌષ્ટિક પશુ આહાર છે.
- અજોલા ખવડાવવાથી પશુઓ, સામાન્ય આહાર ખાવા વાળા પશુઓ કરતા સારો અનુભૂતિ સ્વારથ્ય કેળવે છે.
- અજોલા ખાવાથી પશુમાં વાંગીયાપણું નિવારી શકાય છે.
- દુધાળા પશુઓમાં દુધ ઉત્પાદન વધારવામાં પણ ઉપયોગી છે.
- એક ક્રીલો અજોલાની ગુણવત્તા એક કિલો ખાણા-દાણાની બરાબર છે.
- પશુઓમાં પેશાબની સાથે લોહી આવવું એ ફોસ્ફરસની ખામીને લીધે થાય છે. એવા પશુઓને અજોલા ખવડાવવાથી ઉષ્ણપદ્ધર થઈ શકે છે.
- છ મહીના જુની અજોલાની ક્યારીની ૨ કિલો માટીમાં ૧ કિલો એન.પી.કે. ખાતરની બરાબર તત્ત્વો રહેલા હોય છે.
- દુધાળા પશુઓમાં ૨ થી ૨.૫ કિલો અજોલા પશુઓને પ્રતિ દિવસ ખવડાવવાથી ૧૫ થી ૨૦% દુધ ઉત્પાદન વધારવામાં આવે છે.

HARVESTING AZOLLA AND FEEDING METHODS



અજોલા ખવડાવવાની રીત

- અજોલા ખવડાવવા એક કિલો દાણમાં એક કિલો અજોલા મિશ્ર ભેગા કરી પશુને ખવડાવવામાં આવે છે જેથી પશુઓના દુધ ઉત્પાદનમાં ૧૫ થી ૨૦ ટકાનો વધારો થાય છે. સાથે સાથે ૨૦ થી ૨૫ ટકા પશુઓના દાણની ખરીદી બચી જાય છે. સામાન્ય દાણા ખાવાવાળી મરદીઓને ૧૦ થી ૧૨ % શારીરીક વિકાસ અને ઈડા, યોકનો વિકાસ અને ઈડાના રંગમાં ગલો આવી જાય છે.

ક્રમ	પશુ	માત્રા/દિવસ
૧	વયસ્ક ગાય, ભેંસ, બળદ	૨ કિલો થી ૨.૫ કિલો
૨	મરધી, પ્રોયલર	૨૦ થી ૩૦ ગ્રામ
૩	બકરી	૩૦૦ થી ૪૦૦ ગ્રામ
૪	ભૂંડ	૧.૫ થી ૨ કિલો
૫	સસલું	૧૦૦ ગ્રામ

